

પેન્શન પેપર્સમાં સુધારો કરવા બાબત.

ગુજરાત સરકાર,
નાણા વિભાગ,
ઠરાવ ક્રમાંક: ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી,
સચિવાલય, ગાંધીનગર.
તા. ૩.૩.૨૦૦૭

સંદર્ભ :

(૧) ના.વિ.નો તા. ૨૩.૩.૨૦૦૦નો પરિપત્ર ક્રમાંક: ડીપીપી/૧૦૮૮/૪૫૬/૮૪૮(૮) / ૫

ઠરાવ :-

સંદર્ભમાં દર્શાવેલ તા. ૨૩.૩.૨૦૦૦ના પરિપત્રથી પેન્શનપાત્ર સરકારી સેવામાંથી નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્શન પેપર્સ નિયત કરવામાં આવેલ છે. હાલના આ પેન્શન પેપર્સના શોર્ટ્સમાં સુધારા વધારા કરવાનું કેટલાંક સમયથી સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતું. કાળજીપૂર્વકની વિચારણાના અંતે આથી સંદર્ભ હેઠળનો પરિપત્ર રદ કરી આ સાથેના પરિશિષ્ટ મુજબનું પેન્શન પેપર્સ ફોર્મ નિયત કરવામાં આવે છે. આ પેન્શન પેપર્સનું ફોર્મ નિયામકશી, પેન્શન અને પ્રોવિન્ટ ફંડ, ગાંધીનગર/ જિલ્લા સહાયક નિરીક્ષકશ્રીને સંબોધીને પેન્શનની અધિકૃતિ કરવા માટે પાઠવવાના પત્ર સાથે નીચે મુજબ પાંચ ભાગમાં છે.

- (૧) પેન્શન પેપર્સ મોકલતી કચેરી/ખાતા/ વિભાગના વડાએ નિયામકશી, પેન્શન અને પ્રોવિન્ટ ફંડની કચેરી, ગાંધીનગર/ જિલ્લા સહાયક નિરીક્ષકશ્રીને પેન્શનની અધિકૃતિ કરવા માટે પાઠવવાના પત્રનો નમૂનો.
- (૨) ભાગ-૧ નિવૃત્ત થતાં કર્મચારીએ નિવૃત્તિના ૨૪ માસ પહેલાં આપવાની વિગતો.
- (૩) ભાગ-૨ કચેરી/ ખાતાના વડાએ આપવાની વિગતો.
- (૪) ભાગ-૩ અવસાન પામેલ કર્મચારીઓના કિસ્સામાં કુટુંબ પેન્શન માટેની અરજી.
- (૫) ભાગ-૪ કચેરીના વડા દ્વારા કુટુંબ પેન્શન મંજૂરી.
- (૬) ભાગ-૫ પેન્શનપાત્ર બિન સરકારી કર્મચારીઓ માટેનું ફોર્મ.

બિન સરકારી સંસ્થાના પેન્શનપાત્ર કર્મચારીના કિસ્સામાં લાગુ પડતાં ભાગ-૧ થી ભાગ-૪ ઉપરાંત પેન્શન ફોર્મનો ભાગ-૫ અવશ્ય ભરવાનો રહેશે.

તા. ૧.૪.૨૦૦૭ અને ત્યારબાદ નિવૃત્ત થતાં/ અવસાન પામતા કર્મચારીઓના કિસ્સામાં તેઓના પેપર્સ આ ઠરાવ સાથે નિયત કરેલ નવા શોર્ટ્સમાં તૈયાર કરીને મોકલી આપવાના રહેશે. તા. ૧.૪.૨૦૦૭ કે ત્યાર પછીની તારીખે નિવૃત્ત થતાં કર્મચારીઓના કિસ્સામાં આ અગાઉ નિયત કરેલ ફોર્મમાં પેન્શન પેપર્સ તૈયાર કરવામાં આવ્યા હોય અને તેના ઉપર જુદા જુદા સ્તરે કાર્યવાહી કરવાની ચાલુ હોય તેવા કિસ્સાઓમાં આ ઠરાવ દ્વારા નિયત કરવામાં આવેલ નવા પેન્શન શોર્ટ્સમાં પેન્શન પેપર્સ નવેસરથી તૈયાર કરવાના રહેશે નહીં.

આ ઠરાવના અમલીકરણમાં જો કોઈ મુશ્કેલી કે તેને લગતાં આનુષ્ઠાનિક પશ્ચો ઉપસ્થિત થાય તો તે અંગે નાણા વિભાગનો નિર્ણય આખરી ગણાશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

બી.ચી. પટેલ
સરકારના નાયબ સચિવ,
નાણા વિભાગ

પ્રતિ,

૧. - માનનીય રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર.
 ૨. માનનીય મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
 ૩. માનનીય સર્વ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ.
 ૪. માનનીય વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર.
 ૫. - રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ.
 ૬. - સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય ગાંધીનગર.
 ૭. - સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.
 ૮. - સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ, ગાંધીનગર.
 ૯. - સચિવશ્રી, ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
 ૧૦. - સચિવશ્રી, ગુજરાત જહેર સેવા આયોગ, અમદાવાદ.
 ૧૧. એકાઉન્ટન્ટ જનરલશ્રી (ઓડિટ-૧), ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ.
 ૧૨. એકાઉન્ટન્ટ જનરલશ્રી (એકાઉન્ટસ એન્ડ એન્ટાઇટલમેન્ટ,) ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ.
 ૧૩. સચિવાલયના સર્વ વિભાગો.
 ૧૪. નાણા વિભાગના સર્વ અધિકારીશ્રીઓ/ નાણા વિભાગની સર્વ શાખાઓ.
 ૧૫. નિયામકશ્રી, હિસાબ અને તિજોરી, ગાંધીનગર.
 ૧૬. નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિન્ટ ફંડ, ગાંધીનગર.
 ૧૭. પગાર અને હિસાબી અધિકારીશ્રી, અમદાવાદ/ગાંધીનગર/વડોદરા(નર્મદા)/ગાંધીનગર (નર્મદા)
 ૧૮. નિવાસી ઓડિટ અધિકારીશ્રી, અમદાવાદ/ ગાંધીનગર.
 ૧૯. સર્વ તિજોરી અધિકારીશ્રીઓ, સર્વ પેટા તિજોરી અધિકારીશ્રીઓ.
 ૨૦. સર્વ ખાતાના વડાઓ, ગુજરાત રાજ્ય.
 ૨૧. સર્વ જિલ્લા કલેક્ટરશ્રીઓ, ગુજરાત રાજ્ય.
 ૨૨. સર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, ગુજરાત રાજ્ય.
 ૨૩. સર્વ મદદનીશ નિરીક્ષકશ્રી, સ્થાનિક લંડેજ હિસાબ, ગુજરાત રાજ્ય.
 ૨૪. સર્વ માન્ય મંડળો.
-ધી વર્ગ ફાળવણી.
- પસંદગી ફાઈલ પી શાખા**

- પત્ર દ્વારા.

નાણાં વિભાગના તા. ઉ/ઉ/૨૦૦૭ ના ઠરાવ ક્રમાંક ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી નું પરિશિષ્ટ

રજી.પો.અ.ડી.

૩૫૩

પત્ર નં.

મોકલ્બનાર કચેરીનું નામ/સરનામું

ડી.પી.પી. કચેરીના ઉપયોગ માટે. માસ્ટર ક્રોડ નં.

--	--	--	--	--	--	--	--

.....
.....
.....

તારીખ :

પ્રતિ,

(૧) નિયામકશ્રી,

પેન્શન અને પ્રોવિઝન ફંડ નિયામકશ્રીની કચેરી,
'વીમા અને લેખા ભવન'
બ્લોક નં. ૧૮, ડા. જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર - ૩૮ ૨૦ ૧૦.

(૨) જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી

.....
.....
જિલ્લો

વિષય : તાઃ ના રોજ નિવૃત્ત થનાર/ થયેલ/ અવસાન
પામેલ શ્રી / શ્રીમતી / સ્વ.
ને મળવા પાત્ર પેન્શનની અધિકૃતી કરવા બાબત.

મહાશય,

ઉપરોક્ત વિષયે આ સાથે શ્રી/ શ્રીમતી/ સ્વ.
કે જેઓ તાઃ ના રોજ નિવૃત્ત થનાર/ થયેલ/ અવસાન પામેલ છે, તેમની નિયમાનુસાર
માહિતી મેળવી પેન્શન પેપર્સ ભાગ-૧ કર્મચારીની વિગતો ભાગ-૨ કચેરી સ્તરની વિગતો ભાગ-૩
અવસાન કેસ માટે ભાગ-૪ અવસાન કેસ માટે કચેરી સ્તરની વિગત. ભાગ-૫ ગ્રાન્ટ ઈન એઈડ
સંસ્થાના કર્મચારી માટે તૈયાર કરી, (લાગુ ન પડતું છેકી નાંખવું) ગુ.મુ.સેવા (પેન્શન) ના નિયમો-
૨૦૦૨ ના નિયમ-૮(૬૦) અનુસાર પેન્શન મંજૂર કરી સેવાપોથી સાથે મોકલેલ છે. તેઓને મળવાપાત્ર
પેન્શન/કુટુંબ પેન્શન/ગ્રેજ્યુલીટી/ પેન્શનનું મુડીકૃત ઉપાંતર વગેરે રકમો અંગે ગુ.મુ.સેવા (પેન્શન)
નિયમો-૨૦૦૨ ના નિયમ-૧૨૮(૭) અન્યથે તિજોરી અધિકારીશ્રીને આપવાપાત્ર થતી અધિકૃતિઓ
આપવા વિનંતી છે.

નિવૃત્ત થનાર કર્મચારીનો દરજા (લાગુ પડતું ટીક કરવું)

(૧) સરકારી રાજ્યપત્રિ

(૪) જિલ્લા પંચાયત કર્મચારી



(૨) સરકારી બીન રાજ્યપત્રિ

(૫) રોજમદારકર્મચારી



(૩) વર્કચાર્જ કર્મચારી

(૬) પેન્શનપાત્ર ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાના કર્મચારી



સ્થળ :

સરી
પેન્શન મંજૂર કરનાર અધિકારી

તારીખ :

નામ :

હોદ્દો :

નોંધ : પ્રતિનિયુક્ત ઉપરના કર્મચારીનો પેન્શન કેસ તેના મુણ ખાતા/ કચેરી મારફતે મોકલવાનો રહે છે

- રાજ્ય સરકાર - ગ્રાન્ટ ઈન એઈડ શાળા કોલેજના કર્મચારીઓના કેસ ડીપીપીએફને મોકલવાના રહેશે. અને જિલ્લા પંચાયત સંવર્ગના કર્મચારીઓના કેસ જિલ્લા સહાયક નિરીક્ષકશ્રીને મોકલવાના રહેશે.

પેન્શન કેસ

ભાગ-૧

વય નિવૃત્તિને કારણે નિવૃત્તા થતાં કર્મચારીએ ર૪ માસ પહેલા અને સૈચિછક નિવૃત્તિ
બેતાં કર્મચારીએ સૈચિછક નિવૃત્તિ તારીખ પછી તુરત જ તેમની કચેરીના વડાને
નિવૃત્તિના લાભો મેળવવા માટે આપવાનું અરજ ફોર્મ

પ્રતિ,

.....
.....
.....

હું શ્રી / શ્રીમતી

દોષો: તા : ના રોજ વયનિવૃત્તા / સૈચિછક

નિવૃત્તિના કારણે નિવૃત્તા થાઉં છું. મારા પેન્શન મંજુરી અર્થ નીચે મુજબની માહિતી ગુમુસેવા

(પેન્શન) નિયમોના નિયમ ૧૨૮(૧) મુજબ રજૂ કરું છું.

૧ સરકારી કર્મચારીનું નામ : અટક નામ પિતા/

પતિનું નામ

.....

(સેવાપોથીમાં નોંધા પ્રમાણો, જો સુધારેલ
હોય તો જેઝેટનો આધાર રાખવો)

૨ હોદ્દો :

૩ કચેરીનું નામ સરનામું અને ફોન નંબર :

(પીનકોડ નંબર સાથે)

D D M M Y Y Y Y

: [] [] [] [] [] [] [] []

: [] [] [] [] [] [] [] []

: [] [] [] [] [] [] [] []

૪ જન્મ તારીખ :

૫ નોકરીમાં દાખલ તારીખ :

૬ નિવૃત્તિની તારીખ :

૭ મારા યોગ્ય રીતે શાખ કરાવેલ / પ્રમાણિત કરાવેલ નીચેના દસ્તાવેજોની ગણ નકલ સામેલ છે : -

(૧) ગુજરાતી તેમજ અંગ્રેજીમાં સહીના ગણ નમૂનાં

(૨) પતિ-પતિના પાસપોર્ટ કદના ગણ સંયુક્ત ફોટોગ્રાફ્સ

(૩) ઉચાઈ - અંગત ઓળખચિન્હ

૮ પત્રવ્યવહારનું સરનામું :

(પીનકોડ અને ટેલીફોન નંબર સાથે)

કચેરીનું સીલ

કર્મચારીની સહી

૯ જે જિલ્લા/ પેટા તિજોરીએથી પેન્શન મેળવવા માંગતા હોય તેનું નામ:

જિલ્લો..... તાલુકો

૧૦ હું મારા મળવાપણ પેન્શનના ટકા ભાગનું મુડીકૃત રૂપાંતર કરી રૂપાંતરની કિમત આપવા આજ તા: ના રોજ વિનંતી કરુછું.

નોંધ : પેન્શનનો રૂપાંતર માટેની અરજી નિવૃત્તિની તારીખ પછીના ૧૨ માસ પછી કરવામાં આવે તો મેડિકલ બોર્ડના પંમાણાપણ સાથે ફોર્મ-૧૬ માં અરજી સામેલ કરવાની રહેશે.

૧૧ કુટુંબની વિગતો : ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમ - ૮૮ મુજબ)

તા..... ના દિવસે મારા કુટુંબના સભ્યોની વિગતો નીચે પ્રમાણે છે :-

ક્રમ નંબર	કુટુંબના સભ્યોના નામ		જન્મતારીખ	કર્મચારી/ અધિકારી સાથે સબંધ	નોંધ નંબર
	૧	૨	૩		
૧					
૨					
૩					
૪					
૫					
૬					

હું બાંહેધરીપુર્વક જાહેર કરુછું. કે મારા કુટુંબની વિગતો આજની તારીખે ઉપર મુજબ છે. તેમાં કોઈપણ ફેરફાર થશે તો કચેરીના / ખાતાના વડાને તેની જાણ કરીશ.

૧૨. સરકારશ્રીના નાણાં વિભાગના તા: ૨૩/૬/૨૦૦૦ ના ઠરાવ કર્માંક ડીપીપી/૧૦૮૮/૪૮૬/૮૪૫ (૪) પી મુજબ નિયત નમુનામાં વારસ નિયુક્તિ ફોર્મની પ્રમાણીત નકલ આ સાથે સામેલ રાખું છું.

૧૩. મારા પુત્ર / પુત્રી શ્રી / કુમારી અંધ/ અપંગ/ મંદબુધિધના છે તેને લગતું સિવિલ સર્જનનું દાકતરી પ્રમાણપત્ર સામેલ રાખેલ છે. તેઓ જીવન નિવીક પુરતુ કમાવા માટે અશક્તિમાન છે. તેમને કુટુંબ પેન્શન ચૂકવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે તેમના વાલી તરીકે શ્રી / શ્રીમતી ને ફરજ બજાવવા નિમું છું.

ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ ૮૩)

૧૪. ઉપર જણાવેલ વિગતોમાં ફેરફાર કે સુધારા વધારા થાય તેવા પ્રસંગે પેન્શન અને પ્રોવિન્ટ ફંડ નિયામકશ્રી/ કચેરીના વડા તેમજ સબંધકર્તાને જાણ કરી અધ્યતન રાખવાની બાંહેધરી આપું છું.
ઉપરની વિગતો મારી કચેરીના વડા સમક્ષ આજ તા: ના રોજ ઉપસ્થિત થઈ પેન્શનની કાર્યવાહી અર્થ આપું છું. (કર્મચારીની માંગની પ્રસંગે કે બહાર ગામ ગયા હોય તેવા પ્રસંગે પ્રતિનિધિ અથવા ટપાલ મારફતે ઉપરની વિગતો મોકલી આપી શકશે.)

સ્થળ :

કચેરીના વડાની સહી

કર્મચારીની સહી

તારીખ :

નામ

નામ:

હોદ્દો

હોદ્દો:

૧૪. વારસ નિયુક્તિ :

- (૧) મારા અવસાનના તુરત પહેલાંના પેન્શન અંગેના લાભો સબધેની તમામ પ્રકારની ચડત લેણી રકમ જેવી કે, પેન્શનની બાકી લેણી રકમ, પેન્શનની મુડીકૃત રૂપાંતરની રકમ, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની ચુકવણી માટે તેમજ નિવૃત્તિ બાદ મારા અવસાન પ્રસંગે મારા ફુટંબને રાહત તરીકેની રકમ ચુકવણી માટે હું આ સાથેની મારી નિયુક્તિની પ્રમાણીત નકલ મુજબ ચુકવણી કરવા વિનંતી કરું છું. (નકલ સામેલ છે.)
- (૨) જો નિયુક્ત સગીર હોય તો
 (ક) જન્મતારીખ :

(અ) સગીર વય દરમ્યાન સદરહુ
 રકમ જે વ્યક્તિને વાલી તરીકે
 આપવાની હોય તેનું
 નામ:

સરનામું (પીનકોડ સહિત)

(ગ) વાલી તરીકે નિયુક્તિનો
 પેન્શનર સાથેનો સબધ.

૧૫. બાંહેધરીપત્ર ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ ૧૩૪/૧૩૫)

આથી હું બાંહેધરી ખત આપું છું કે, હું
 તા: ના રોજ નિવૃત્ત થાઉં છું. તે પછીથી મારી પાસેથી કોઈપણ સરકારી લેણું/જેવું કે, પગાર, રજાપગાર, ભથ્યા, લીધેલ પેશગીઓ, લીન, ધરભાડા અંગે થયેલ અધિક ચુકવણીઓ સામે બાકી રહેતી રકમ પગારધોરણાની સુધારણા કરતા થયેલ અધિક ચુકવણી અથવા અન્ય સરકારી લેણું બાકી જડાય તો તે મારા પેન્શન/ મૃત્યુ-સહ-ગ્રેજ્યુઈટીમાંથી ભરપાઈ કરવા બાંહેધરી/ સંમતિ આપું છું. નિવૃત્તિ બાદ સરકારી રહેણાંક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો વસૂલ કરવા પાગ થતું મકાનભાડુ મને મંજૂર કરવામાં આવેલ પેન્શન/ ફુટંબ પેન્શન અને તે પર મળવાપાત્ર ટી.આઈ.માંથી તિજોરી કક્ષાએ વસૂલાત કરવા બાંહેધરી તેમજ સંમતી આપું છું.

સ્થળ :

તારીખ :

કર્મચારીની સહી

નામ:

હોદ્દો :

કચેરીના વડાની સહી

નામ

હોદ્દો

પેન્શન કેસ

ભાગ-૨

નિવૃત્ત થનાર/થયેલ કર્મચારીની કચેરીના વડાએ/ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ
નિયામકશી / જલ્દી સહાયક નિરીક્ષકશીને પૂરી પાડવાની વિગતો.

૧ સરકારી કર્મચારીનું નામ : અટક નામ પિતા/
પતિનું નામ
ગુજરાતીમાં →

અંગ્રેજીમાં (in block letters)

(સેવાપોથીમાં નોંધા પ્રમાણો, જો
સુધારેલ હોય તો ગેજેટનો આધાર
રાખવો)

Surname	<input type="text"/>						
First name	<input type="text"/>						
Second name	<input type="text"/>						

૨ હોટો : ગુજરાતીમાં →

અંગ્રેજીમાં(in block letters)→

૩. જન્મતારીખ આંકડામાં :

૪. નોકરીમાં દાખલ તારીખ :

૫. નિવૃત્તિની તારીખ :

૬. પેન્શનનો પ્રકાર (ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ મુજબ) (લાગુ પડતું હોય તે ટીક
કરવું)

(૧) વધ નિવૃત્તિ પેન્શન (૨) નિવૃત્તિ પેન્શન (અપરિપક્વ નિવૃત્તિ)

(૩) સૈંચિક નિવૃત્તિ પેન્શન (૨૦ વર્ષ
પછી) (૪) અશક્તતા પેન્શન

(૫) સૈંચિક નિવૃત્તિ પેન્શન (૨૫ વર્ષ
પછી) (૬) દા અથવા ઈજા પેન્શન

(૭) કુટુંબ પેન્શન (૮) વળતર પેન્શન

(૯) રહેમિયત પેન્શન (૧૦) અન્ય પ્રકાર

૨૦ વર્ષની નોકરી બાદ સૈંચિક નિવૃત્તિ હોય તો નોશનલ નિવૃત્તિની તારીખ:

ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૪૮)

અથવા

૨૫ વર્ષની નોકરી બાદ સૈંચિક નિવૃત્તિ હોય તો નોશનલ નિવૃત્તિની તારીખ:

ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૪૯)

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

૭ કર્મચારીનું પત્ર વ્યવહારનું સરનામું : _____
(પીનકોડ અને ટેલીફોન નંબર
ઈ મેઇલ સાથે) _____

૮ કમચારીનો શ.પી.ઓફ. નબર :

૬. કમાચારી રાજ્યપત્રિત છે કં : રાજ્યપત્રિત બિન રાજ્યપત્રિત
 બિનરાજ્યપત્રિત છે ?
 (તે ટીક કરવું.) :

૧૦ કચેરીનું નામ સરનામું અને ફોન નંબર :
 (પીનકોડ નંબર સાથે)
 ફેક્સ નંબર / ઈ-મેઈલ
 (અંગ્રેજ અને ગુજરાતીમાં)

૧૧ ખાતાના વડા

કોડ નંબર : :

--	--	--	--

१२ विभागनुं नाम : _____

કોડ નંબર : _____ : _____

૧૩ કર્મચારી જે જિલ્લા/ પેટા તિઝોરીએથી પેન્શન મેળવવા માંગતા હોય તેનું નામ :
 જીલ્લો તાલુકો

૧૪ યોગ્ય રીતે શાખ કરાવેલ (૧) ગ્રાણ સહીના નમૂનાઓ (૨) સરકારી કર્મચારી સાથે તેમના પતિ/પતિન સાથે પાસપોર્ટ કદના સંયુક્ત ફોટોની ગ્રાણ નકલ (પતિ/પતિની ન હોય તો સીંગલ ફોટો, કુટુંબ પેન્શનમાં સીંગલ ફોટો, ગાર્ડિયનશીપ હોય તો ગાર્ડિયન સહિતના ફોટો) (૩) ઉંચાઈ અને અંગત ઓળખ વિન્હની વિગત દર્શાવતી બે કાપલીઓ આ સાથે કર્મચારીની અરજ સહિત સામેલ છે.

૧૫ કામચલાઉ પેન્શન / મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઝની / કુટુંબ પેન્શન મંજૂર કરેલ હોય તો તેની વિગતી

કામચલાઉ પેન્શન ૩૧ ટાં ૬૩ થી

કામચલાઉ મૃત્યુ-સહ-નિવૃત્તિ રૂ. તાઃ થી

કામચલાર્થ કંટાંગ પેન્શન 31

શ્રી/શ્રીમતી ને હુકમ કર્માંક :
....., તા.
થી મંજૂર કરેલ છે.

કયેરીનું સીલ

ਕਥੇ ਰੀਨਾ ਵਡਾਨੀ ਸਹੀ

૧૬ નિવૃત્તિ બાદ અવસાન થતાં કુટુંબ પેન્શનને પાત્ર પત્તિ / પત્તિ / સંતાન /માતા / પિતાનું નામ :
(ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨
ના નિયમ-૮૧ (૫), નિયમ-૮૨ ની
શરતો પરિધૂર્ણ થતી હોય તો))

અટક નામ પિતા/ પતિનું નામ

ગુજરાતીમાં →

.....

અંગરુદ્ધમાં (in block letters) →

Surname								
First name								
Second name								

૧૭ કર્મચારી પેન્શનનું મુડીકૃત રૂપાંતર મેળવવા

માંગતા હોય તો માંગણી કર્યાની અરજી તારીખ

મુડીકૃત રૂપાંતર માટેના ટકા (મહત્વમાં ૪૦ ટકા ન્યાયિક સેવાના અધિકારી માટે ૫૦ ટકા)

ગુ.મુ.સેવા (પે-ન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૬ થી ૧૨૩)

૧૮ કર્મચારીએ તેમના અવસાન સમયે :

પેન્શન / મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેડ્યુઇટી/

पे-न्शन दृपांतर युक्तवा माटे नियुक्त करेल :

नोभिनीनुं नाम (नाशां विभागना

ઠરાવ તારીખ: ૨૩/૬/૨૦૦૦ મુજબનું) અટક નામ પિતા/પતિનું નામ

.....
.....

નોંધ : - (૧) અનુક્રમ નં. ૧૮ ના સમર્થનમાં નોભીનેશનની પ્રમાણિત નકલ સામેલ રાખવી.

(૨) અનુક્રમ નં. ૧૬ માં નામ દર્શાવતાં ચોકસાઈકરી લેવી, જેથી ભવિષ્યમાં દાવો ચુકવવામાં મધુકેલી ઉપસ્થિત ન થાય.

ਕਥੇਰੀਨਾਂ ਸੀਲ

ਕੁਝ ਰੀਨਾ ਵਡਾਨੀ ਸਲੀ

એ એકંદર નોકરી તા:થી તા:

--	--	--	--	--

બાદ પેન્શન માટે ન ગજાવાનો સમય

(૧) ઉદ્ માસથી વધારે અસાધારણ રજા

તા.....થી તા.

તા.....થી: તા.

(૨) પેન્શનપાત્ર નોકરી તરીકે ન ગજાવાના હુકમો થયા
હોય તેવો ફરજ મોકુફીનો સમય.

તા.....થી: તા.

તા.....થી: તા.

(૩) ગ્રાસ માસ કરતાં વધારે મુદ્દતની તૂટ હોય ત્યાં
બે ગાળા વચ્ચેનો તૂટનો સમય

તા.....થી: તા.

તા.....થી: તા.

(૪) પેન્શનપાત્ર નહીં ગણાતી અન્ય મુદ્દતો

તા.....થી: તા.

તા.....થી: તા.

(૫) પેન્શનપાત્ર નહીં ગણાતી નોકરીનો સરવાળો. (૧) થી (૪)

(બી) ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી (એ - (૫))

(સી) ૨૦/૨૫ વર્ષો સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો ઉમેરવાપાત્ર

થતી હોય તેવી નોશનલ નોકરી.

ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૪૮/૪૮ અનુસાર) (વધુમાં પાંચ વર્ષ)

(ડી) ન્યાયિક સેવાના અધિકારી/ મદદનીશ સરકારી વકીલ માટે

ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૩૭ મુજબ મળવાપાત્ર

નોશનલ નોકરી કુલ (બી + સી + ડી)

(૬) ગજાતરીમાં લેવાની પૂરા વર્ષમાં નોકરી.

નોંધ : પેન્શનપાત્ર નોકરીમાં આવતા સમયમાં પુરા કરેલ વર્ષ ઉપરાંત જો છ માસ કરતાં ઓછો

સમય હોય તો ગજાતરીમાં ન લેવો, પરંતુ છ માસ અને તે કરતા વધુ સમયને પુરા આખા

વર્ષ તરીકે ગજાતરીમાં લેવો. (મહાત્મ પેન્શનપાત્ર નોકરી ઉત્ત વર્ષ)

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

૨૦ નિવૃત્તિ / અવસાન / ૨૦ વર્ષ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ સમયનો છેલ્લો પગાર : રૂ.....

૨૧ ૨૫ વર્ષ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો નોશનલ નોકરીની છેલ્લી તારીખે સંભવિત નોશનલ પગાર : રૂ.....

૨૨ ખરેખર મેળવેલ પેન્શનપાત્ર પગારની વિગતો (ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૪૩)
તાઃ થી તાઃ

(૨૫ વર્ષ બાદની સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો નોશનલ પગાર ધ્યાને લેવો)

કુમ માસ પગારનો દર ૫૦% ડિએ નોન પ્રેક્ટીસ એલાઉન્સ ૩૧. પૈ.

सरवाणो दश. मास

માસિક સરેરાશ પેન્શનપાત્ર પગાર

છેલ્લા આર.ઓ.પી.ની ચકાસણી એલ.એફ. કચેરોએ કરેલ છે અને ત્યારપણીના વાર્ષિક ઈજાફા તથા બઢતી વગેરે અન્વયે નિયત કરી ચુકવવામાં આવેલ પગાર મેં ચકાસણી કરેલ છે અને બરાબર જણાયેલ છે. તે મુજબ પેન્શનપાત્ર પગાર ગણતરીમાં લીધેલ છે. (ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ ૧૩૦, ૧૩૧)

નોંધ : (૧) કર્મચારીની નિવૃત્તિના દસ માસ પૂર્વે છિલ્લા દસ માસમાં વર્ગાર પગારની રજા (LWP) હોય તો તે મુજબ તેમનો વગર પગારની રજા (LWP) ના પૂર્વેના સમયનો ચુકવેલ પગાર દસ માસના હેતુ માટે ધ્યાને લેવો.

(૨) કર્મચારી ફરજ મોકુફી પર હોય અને તે સમયને ફરજ મોકુફી તરીકે જ ગણોલ હોય તો જો કર્મચારી ફરજ મોકુફી પર જતા પહેલાં મેળવેલ પગારના દસ માસના હેતુ માટે ધ્યાને લેવો.

(૩) કર્મચારી અર્ધપગારી રજા પર હોય તો તે જો રજા પર ગયા ન હોત તો અને ફરજ ઉપર હોત અને તે જે પગાર મેળવવા પાત્ર હોય તેપગાર દસ માસના હેતુ માટે ધ્યાને લેવો.

ਕਚੇ ਰੀਨਾਂ ਸੀਲ

કચેરીના વડાની સહી

૨૩ પેન્શનની ગણતરી : (ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૮૦)

(१) पेन्शनपारा पगार \times पेन्शनपारा नोकरी (वधुमां वधु उड वर्ष) = प्रेन्शन

55

1

(૨) જો કોઈ કિસ્સામાં ઉપર જડાવેલ મુજબનું પેન્શન રીવીઝન ઓફ પે-૮૮ ના પગારધોરણ મુજબ છેલ્લે જગ્યા ધરાવતા હોય તેના સેલના લઘુતમના ૫૦% કરતાં ઓછું થતું હોય તો પગારધોરણના લઘુતમ પગારના ૫૦ ટકા મુજબ પેન્શન રહેશે.

ਲਾਈਟਮ ਪਗਾਰੇ = =

ઉપરોક્ત (૧) અથવા (૨) પૈકી જે વધારે હોય તે = ૩.....

૨૪. કુટુંબ પેન્શન ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૫૦ (૧) (૨)

(१) निवृत्ति बाट अवसान

(એ) કુટુંબ પેન્શન-૧

અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા કર્મચારી જીવતા હોત અને દય વર્ષની ઉમરે પહોંચે ત્યાં સુધી આ બે પેકી જે વહેલું હોય ત્યાં સુધી નીચે મુજબ ફુંદુંબ પેન્શન મળવાપાત્ર બનશે.

- કર્મચારીને મંજૂર થયેલ પેન્શન જેટલી રકમ હું.*

(નોંધ : કોઈપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% કરતાં ઓછી નહી તેટલી રકમ હોવી જોઈએ. એટલે કે છેલ્લા પગારના 30%

છેલ્લો પગાર * x. 30% = રૂ.

(બી) કુટુંબ પેન્શન-૨

ઉપર (૧) (એ) માં દર્શાવેલ સમયગાળા બાદ મળવાપાત્ર કુટુંબ

છેલ્લા પગારના 30 % જેટલી રકમ ઝા.

$$\text{છેલ્ખો પગાર} \dots \times 30\% = 31. \dots$$

ਫਿਰੀਨਾਂ ਸੀਲ

કાંગડીના લક્ષણી અધી

(2) ચાલુ નોકરીમાં અવસાન : (નિયમ - ૮૦ (૧) (૧))

(ઓ) કુટુંબ પેન્શન-૧ :-

ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે અવસાનની તારીખ પછીની તારીખથી પ્રથમ સાત વર્ષ માટે પરંતુ કર્મચારી જીવતા હોત અને ઇપ વર્ષની ઉમરે પછોંચે તે તારીખ સુધી બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી નીચે મુજબ કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે.

છેલ્લા પગારના ૫૦ % જેટલી રકમ રૂ.

છેલ્લો પગાર \times ૫૦% = રૂ.

કુટુંબ પેન્શન-૨ :-

(બી) ત્યારબાદ એટલે કે કર્મચારીના અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ, પછી

છેલ્લા પગારના ૩૦ % જેટલી રકમ રૂ.

છેલ્લો પગાર \times ૩૦% = રૂ.

૨૫. મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઝ્ટી / સેવા ગ્રેચ્યુઝ્ટી :

(અ) મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઝ્ટી (ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૮૧) (૧) (ઓ)

૧. નિવૃત્તિ સમયે

(છેલ્લો પગાર + મોંઘવારી) \times પેન્શનપાત્ર નોકરી વર્ષ (મહત્તમ ઉત્ત વર્ષ) =

ર

(..... +) \times =)

ર

૨. ચાલુ નોકરીએ અવસાન સમયે : ગુ.મુ.સ. (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૧ (૧) (બી)

(એ) એક વર્ષ કરતાં ઓછી પેન્શનપાત્ર નોકરી હોય તે પ્રસંગે

(છેલ્લો પગાર + મોંઘવારી) \times ૨ = (----- + -----) \times ૨ = રૂ.

(બી) એક વર્ષ કે તે કરતાં વધું પરંતુ પાંચ વર્ષ કરતાં ઓછી પેન્શનપાત્ર નોકરી હોય તે પ્રસંગે

(છેલ્લો પગાર + મોંઘવારી) \times ૬ = (----- + -----) \times ૬ = રૂ.

(સી) પાંચ વર્ષ કે વધું પરંતુ ૨૦ વર્ષ કરતા ઓછી પેન્શનપાત્ર નોકરી હોય તે પ્રસંગે

(છેલ્લો પગાર + મોંઘવારી) \times ૧૨ = (----- + -----) \times ૧૨ = રૂ.

(ડી) ૨૦ વર્ષ કે તેના કરતા વધું નોકરી હોય ત્યાં મહત્તમ ઉત્ત વર્ષની મર્યાદામાં જેટલા

વર્ષની પેન્શનપાત્ર નોકરી હોય તેટલા પગાર

(છેલ્લો પગાર + મોંઘવારી) \times પુરા કરેલ પેન્શનપાત્ર નોકરીના વર્ષ (મહત્તમ ઉત્ત વર્ષ)

(----- + -----) \times ----- વર્ષ = રૂ.

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

૨૬. સેવા ગ્રેજ્યુલ્ટી :

૧૦ વર્ષ કરતાં ઓછી પેન્શનપાગ નોકરીના ડિસ્સમાં સેવા ગ્રેજ્યુલ્ટી ગુમુસેવા (પેન્શન)

નિયમોના નિયમ ૮૦) (છેલ્લો પગાર + મોઘવારી) \times પુરી કરેલ પેન્શનપાગ નોકરીના વર્ષ =

રૂ.

$$(\text{-----} + \text{-----}) \times \text{-----} \text{ વર્ષ} = રૂ.$$

૨૭. પેન્શનની રકમનું મુડીકૃત રૂપાંતર : ગુમુસેવા (પેન્શન) નિયમોના નિયમ -૧૦૦)

પેન્શનના મુડીકૃત રૂપાંતર માટે નજીકની ઉમરના આખારે એક રૂપીયાની રૂપાંતર કરેલ રકમ માટે
મુડીકૃત રકમ :

ઉંમર	દર	ઉંમર	દર	ઉંમર	દર	ઉંમર	દર
૨૮	૧૭.૬૩	૪૪	૧૪.૬	૫૮	૧૦.૪૬	૭૪	૫.૭૨
૩૦	૧૭.૭૮	૪૫	૧૪.૬૧	૬૦	૧૦.૧૩	૭૫	૫.૪૪
૩૧	૧૭.૬૨	૪૬	૧૪.૩૮	૬૧	૮.૮૧	૭૬	૫.૧૭
૩૨	૧૭.૪૬	૪૭	૧૪.૧	૬૨	૮.૪૮	૭૭	૪.૮
૩૩	૧૭.૨૮	૪૮	૧૪.૮૨	૬૩	૮.૧૪	૭૮	૪.૬૪
૩૪	૧૭.૧૧	૪૯	૧૩.૪૪	૬૪	૮.૮૨	૭૯	૪.૪
૩૪	૧૬.૮૨	૫૦	૧૩.૨૫	૬૫	૮.૪૦	૮૦	૪.૧૭
૩૬	૧૬.૭૨	૫૧	૧૨.૮૫	૬૬	૮.૧૦	૮૧	૩.૮૪
૩૭	૧૬.૪૨	૫૨	૧૨.૬૬	૬૭	૭.૮૪	૮૨	૩.૭૨
૩૮	૧૬.૩૧	૫૩	૧૨.૩૪	૬૮	૭.૫૩	૮૩	૩.૫૨
૩૯	૧૬.૦૮	૫૪	૧૨.૦૪	૬૯	૭.૨૨	૮૪	૩.૩૨
૪૦	૧૫.૮૭	૫૫	૧૧.૭૩	૭૦	૬.૬૧	૮૫	૩.૧૩
૪૧	૧૫.૬૪	૫૬	૧૧.૪૨	૭૧	૬.૬		
૪૨	૧૫.૪૦	૫૭	૧૧.૧	૭૨	૬.૩		
૪૩	૧૫.૧૪	૫૮	૧૦.૭૮	૭૩	૬.૦૧		

રૂપાંતર પેન્શન ભાગ \times રૂપાંતર દર \times ૧૨ = રૂ.

$$\dots \times \dots \times ૧૨ = રૂ.$$

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

૨૮. નિવૃત્તિ લાભોમાંથી કપાત કરવાની હોય તો તેની વિગત.

(૧) પેન્શનમાંથી કપાત રૂ.....તા:.....થી તા:.....સુધી

રૂ.....તા:.....થી કાયમી કપાત

પેન્શનમાં કપાત કરવાના શિક્ષાના હુકમ નં.તા:

.....પેન્શન કાપના શિક્ષાના હુકમ ની નકલ આ સાથે સામેલ છે.

(૨) સરકારી કર્મચારી પાસેથી લેણી રકમની વિગતો નીચે મુજબ છે. ગુ.મુ.સેવા (પેન્શન)

નિયમોના નિયમ ૧૩૩/૧૩૪/૧૩૫)

ક્રમ વિગત	ખાતા નંબર	મુદ્દુલ	વ્યાજ	કુલ જમા કરવાનું અંદાજપત્ર સદર
૧ મકાન પેશગી				
૨ વાહન પેશગી				
૩ પગારભથ્થાની વસૂલાત				
૪ અન્ય વસૂલાત				
		કુલ વસૂલાત		
<u>અંકે રૂપીયા</u>				

ઉપર જણાવેલ વિગતે રકમ સરકારી લેણાં પેટે મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુલ્ટી / સેવા ગ્રેચ્યુલ્ટીમાંથી વસૂલાત કરી જમા કરવા વિનંતી છે.

- માણપત્રો :

(૧) આથી સમગ્રપણે ખારી કરી પ્રમાણિત કરવામાં આવે છે કે, આજની તારીખે

શ્રી/ શ્રીમતી પાસે કશું સરકારી લેણું
બાકી નથી.

કચેરીનું સીલ :

તારીખ :

પેન્શન મંજૂર કરનાર અધિકારીની સહી

નામ :

ડોટ્ટો :

૨૮. ખાતાકીય તપાસ પ્રમાણપત્ર : ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૧૩૮)

આથી સમગ્રપણે ખાતી કરી પ્રમાણીત કરવામાં આવે છે કે, શ્રી/ શ્રીમતિ _____ ની
સામે આજની તારીખે કોઈ ખાતાકીય તપાસ બાકી નથી.

તારીખ :

સહી :

સક્ષમ અધિકારીની

નામ :

હોદ્દો :

૩૦. પેન્શનપાત્ર નોકરી અંગેનું પ્રમાણપત્ર : ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ -૧૩૧)

આથ પ્રમાણીત કરવામાં આવે છે કે શ્રી

તા : ના રોજ વયવિનૃતા/સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ/ થનાર છે/ અવસાન
પામેલ છે. તેમની સેવાપોથીની ચકાસણી કરતાં તેમની સમગ્રનોકરી દરમ્યાનની ગાડા માસથી વધુ
સમયની કોઈપણ જાતની સેવાતૂટ બાદ કરવાની રહી જતી નથી તેમજ ફરજ મોકુફીનો પેન્શનપાત્ર
ન ગણેલ સમય બાદ કરવાનો રહી જતો નથી. તેમજ તેમની ઉદ માસ કરતાં વધુ સમયની
અસાધારણ રજા બાદ કરવાની રહી જતી નથી. તેમજ સમગ્ર નોકરી દરમ્યાનનો તેમની રજાનો
હિસાબ પૂર્ણ કરેલ છે અને છેલ્લા બે વર્ષની સેવાની ચકાસણી કરી સેવાપોથીમાં પ્રમાણપત્ર
આપેલ છે.

૩૧. ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો -૨૦૦૨ના નિયમ-૮(૬૦) અન્વયે મળેલ સત્તાની રૂઘેથી
શ્રી..... હોદ્દો.....ને પેન્શન મંજૂર
કરે છું.

સ્થળ :

કચેરીના વડાની સહી

કચેરીનું સીલ

પેન્શન મંજૂર કરનાર અધિકારીની સહી

નામ :

હોદ્દો :

પેન્શનરની ઓળખની નિશાની / ઉચાઈ / સહીના નમૂના અને ફોટો

(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમો-૧૩૬, ૧૩૭ અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)


કલર ફોટો સાઈઝ 4.5 cm x 3.5 cm સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ.

(જો પેન્શનર સગીર કે, માનસીક અપંગ હોય, તો જ વાલીનો ફોટો ચોટાડવાનો રહેશે.)


શ્રી _____ હોદ્દો _____

ક્યેરી / ખાતુ / વિભાગ નિવૃત્તિની તારીખ _____

ઓળખની અંગતનિશાની ઉચાઈ સહીનો નમૂનો



સંયુક્ત ફોટો વાલી નો ફોટો



ક્યેરીના વડાની સહી

પ્રમાણિત કરનાર ક્યેરીના વડાની સહી

તારીખ :

નામ :

.....
.....
.....

હોદ્દો :

આ પાન ઉપર કોઈ લખાણ કરવું નહીં.

પેન્શનરની ઓળખની નિશાની / ઊંચાઈ / સહીના નમૂના અને ફોટો

(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમો-૧૩૬, ૧૩૭ અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)
કલર ફોટો સાઈઝ 4.5 cm x 3.5 cm સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ.


(જો પેન્શનર સગીર કે, માનસીક અપંગ હોય, તો જ વાલીનો ફોટો ચોટાડવાનો રહેશે.)

શ્રી _____

હોદ્દો _____


કચેરી / ખાતુ / વિભાગ નિવૃત્તિની તારીખ _____

ઓળખની અંગતનિશાની ઊંચાઈ સહીના નમૂનો



સંયુક્ત ફોટો

વાલી નો ફોટો



કચેરીના વડાની સહી

પ્રમાણિત કરનાર કચેરીના વડાની સહી

તારીખ :

નામ :

.....
.....

હોદ્દો :

આ પાન ઉપર કોઈ લખાણ કરવું નહીં.

પેન્શનરની ઓળખની નિશાની / ઉંચાઈ / સહીના નમુના અને ફોટો

(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ના નિયમો-૧૩૬, ૧૩૭ અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)


કલર ફોટો સાઈઝ 4.5 cm x 3.5 cm સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ.

(જો પેન્શનર સગીર કે, માનસીક અપંગ હોય, તો જ વાલીનો ફોટો ચોટાડવાનો રહેશે.)

શ્રી _____ હોદ્દો _____


કચેરી / ખાતુ / વિભાગ નિવૃત્તિની તારીખ _____

ઓળખની અંગતનિશાની ઉંચાઈ સહીનો નમૂનો



સંયુક્ત ફોટો

વાલી નો ફોટો



કચેરીના વડાની સહી

પ્રમાણિત કરનાર કચેરીના વડાની સહી

તારીખ :

.....

નામ :

હોદ્દો :

.....

આ પાન ઉપર કોઈ લખાડા કરવું નહીં.

પેન્શન કેસ

ભાગ-૩

કુટુંબ પેન્શન માટેની અરજી

(સરકારી કર્મચારી નોકરી દરમ્યાન અવસાન પામે ત્યારે ઉપયોગમાં લેવાનું ફોર્મ)

પ્રતિ,

(કચેરી/ ખાતા/ વિભાગના વડા)

..... ની કચેરી / વિભાગમાં
(હોદ્દો)તરીકે ફરજ બજાવતા મારા પતિ / પતિની સ્વ.
શ્રી/ શ્રીમતી.....નું તા. ના
રોજ અવસાન થયેલ છે તે અન્વયે કુટુંબ પેન્શન/ મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી માટેની અરજી નીચે વિગતે
રજી કરી છું.

(ઉક્ત મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુએટીના હિસ્સા માટે અરજી હોય તો લાગુ પડતા કોલમ ભરવા)

૧) અરજદારનું નામ:-

૨) અરજદારનું સરનામુ

૩) અવસાન પામેલ કર્મચારી સાથે સબંધ -

૪) અવસાનની તારીખે સ્વ. ના કુટુંબના સભ્યોની વિગત.

કમ સભ્યનું નામ જન્મ તારીખ પરાણિત/ અપરાણિત કર્મચારી સાથેનો સબંધ વિશેષ નોંધ

૧.

૨.

૩.

૪.

૫.

૬.

ઉપર દર્શાવેલ સભ્યો પૈકી ક્રમાંક : ઉપર દર્શાવેલ શ્રી / કુમારી એ સ્વ. ના
પુત્ર/ પુત્રી અંધ/ અપંગ/ મંદ બુધિના છે અને જીવન નિર્વાહ પુરતનું કર્માવવા માટે
અશક્તિતમાન છે અને આ મતલબનું સીવીલ સર્જનનું મેરીકલ પ્રમાણપત્ર આ સાથે સામેલ
છે. પ્રસંગ ઉપસ્થિત થયે તેમના વાલી તરીકે શ્રી ને વાલી
તરીકે ફરજ બજાવવાની નિમ્નું છું. શુ. મુ. સેવા (પેન્શન) નિયમોના નિયમ ૮૩) મારું
પેન્શન / મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુએટી મને જિલ્લા તિજોરી / પેટા
તિજોરી મારફતે ચુકવવા વિનંતી છે.

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી

અરજદારની સહી

(૬) વારસ નિયુક્તિ :-

મારા અવસાનના તુરત પહેલાના સમયની ચડત કુટુંબ પેન્શનની બાકી રકમ, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુએટી અન્ય કોઈ રીવીજન લાભની ચુકવણી માટે નીચે જણાવેલ વ્યક્તિને નિયુક્ત કરું છું.

૧ નિયુક્તાનું નામ:

સરનામું
.....

જન્મતારીખ						
-----------	--	--	--	--	--	--

૨ પેન્શનર સાથે સબંધ:

૩ જો નિયુક્ત સગીર હોય તો સગીર વય દરમ્યાન

જેને વાલી નિયુક્ત કરેલ હોય તેનું નામ સરનામું:

૪ જો આસન-૧ માં જણાવેલ નિયુક્તનું પેન્શનર

પહેલાં અવસાન થાય તેવા પ્રસંગે અન્ય નિયુક્તાનું

નામ, સરનામું, જન્મતારીખ, પેન્શનર સાથે સબંધ:

૫ જો અન્ય નિયુક્તા સગીર હોય તો સગીર વય દરમ્યાન

જેને વાલી નિયુક્ત કરેલ હોય તેનું નામ સરનામું

૬ આથી હું શ્રી/ શ્રીમતિ કુમારી બાંધેધરી ખત

આપું છું કેમારા પતિ/ પતિ/ પિતા/ માતા સ્વ શ્રી/ શ્રીમતિ

ના તા: ના રોજ થયેલ અવસાન પહેલાનું કોઈપણ સરકારી લેણું જેવું કે,

પગાર, રજાપગાર, ભથ્થા, લીધેલ પેશગીઓ, લોન, ધરભાડા અંગે થયેલ અધિક ચુકવણીઓ સામે

બાકી રહેતી રકમ, પગારધોરણાની સુધારણા કરતા થયેલ અધિક ચુકવણી અથવા અન્ય સરકારી

લેણું બાકી જણાય તો તે મારા કુટુંબ પેન્શન/ મૃત્યુ-સહ-ગ્રેજ્યુએટીમાંથી ભરપાઈ કરવા

બાંધેધરી/સંમતિ આપું છું. સ્વ શ્રી/ શ્રીમતિ ના

અવસાન બાદ સરકારી રહેણાંક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો વસૂલ કરવા પાત્ર થતું

મકાનભાડુ મને મંજૂર કરવામાં આવેલ કુટુંબ પેન્શન અને તે પર મળવાપાત્ર ટી.આઈ.માંથી

તિજોરી કશાએ વસૂલાત કરવા બાંધેધરી તેમજ સંમતી આપું છું. ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના

નિયમ ૧૩૪/૧૩૫)

૭ આથી હું જાહેર કરું છું કે માંગણી કરવામાં આવેલ ગ્રેજ્યુએટી માટે પાત્ર બનાવતી નોકરીના કોઈ ભાગ માટે અરજી કરી નથી તેમજ હવે પછી અરજી કરીશ નહીં.

૮. સહી અથવા ડાબા હાથના અંગુઠાની છાપ :

તારીખ :

શાખ કરી :

અરજદાર રહેતા હોય તે ગામ/નગર અથવા પરગણાની બે કે તેથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ
શાખ કરવી.

ક્રમ નામ

સરનામું

સહી

(૧)

(૨)

સ્થળ :

અરજદારની સહી

તારીખ :

કચેરીના વડાની સહી

પેન્શન કેસ -

ભાગ-૪

**કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે કચેરીના વડાએ મંજૂર કરેલ
કુટુંબ પેન્શન**

૧ કર્મચારીનું નામ :

૨ કર્મચારીનો હોદ્દો:

૩ અવસાન તારીખ

--	--	--	--	--	--	--

(અવસાન દાખલાની પ્રમાણિત નકલ સામેલ રાખવી):

૪ સરકારી કર્મચારીની પેન્શનપાત્ર નોકરી : વર્ષ માસ/દિવસ ...

૫ સરકારી કર્મચારીનું અવસાન સમયનું પગારથોરણ : ૩.....

૬ સરકારી કર્મચારીનો છેલ્લો મુળ પગાર : ૩.....

૭ સ્વ..... ના કુટુંબની વિગતો ચકાસણી કરી પ્રમાણિત કરવામાં આવેલ છે અને તેમના / પતિ/ પત્રી/ પુરુષ/ પુરી શ્રી/ શ્રીમતી/ કુમારી ને કુટુંબ પેન્શન/ ગ્રેજ્યુરી મંજૂર કરે છું.

અથવા

સ્વ..... અવસાનની તારીખે કુટુંબ ધરાવતા ન હતા. તેમના પર આધારીત માતા / પિતા / શ્રી / શ્રીમતી ને કુટુંબ પેન્શન મંજૂર કરે છું.

૮. સ્વ. શ્રી/ કુમારી..... ના અપંગ પુરુષ/ પુરી શ્રી /

૯. સ્વ. શ્રી અવસાનની તારીખે કોઈ ખાતાકીય તપાસ સૂચિત કે બાકી ન હતી/ સૂચિત કે બાકી તપાસ પડતી મુકવામાં આવી છે. (હુકમની નકલ સામેલ છે)

૧૦ સ્વ..... ને કુટુંબ પેન્શન જિલ્લા તિજોરી/પેટા તિજોરી મારફતે પેન્શન ચુકવણી કરવાની છે.

૧૧ સ્વ..... ની અવસાન તારીખે કોઈ સરકારી લેણું બાકીમાં નથી.

અથવા

સ્વર્જસ્થની અવસાન તારીખે નીચે મુજબનું સરકારી લેણું બાકી છે, જે ડી.સી.એસ.આર.જી.માંથી વસુલ લેવાનું છે :-

ક્રમ	વિગત	ખાતા નંબર	મુદ્દા	વ્યાજ	કુલ	જમા કરાવવાનું અંદાજપત્ર સંદર
૧	મકાન પેશગી					
૨	વાહન પેશગી					
૩	પગારભથ્થાની વસુલાત					
૪	અન્ય વસુલાત					
	કુલ વસુલાત					
	અંકે રૂપીયા					

કચેરીનું સીલ

કચેરીના વડાની સહી.

૧૨. સ્વ. એ તેમની હ્યાતી દરમ્યાન કરેલ નિયુક્તિ અનુસાર
શ્રી ને મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુર્ટી ચુકવવાની છે.

૧૩. સ્વ. એ નિયુક્તિ કરેલ ન હોઈ, અવસાનની તારીખે કર્મચારીની
ગ્રેજ્યુર્ટી મેળવવાને પાત્ર હોય, તેવા ફુટુંબના સલ્યોની વિગત.

(એ) વિધવા પતિ /પતિ, અપરાણિત પુત્ર/ પુત્રી, વિધવા પુત્રીઓ

૧.

૨.

૩.

૪.

૫.

(બી) પિતા/ માતા, અઠાર વર્ષથી નીચેની ઉમરના બાઈઓ, અપરાણિત બહેનો, પરણીત પુત્રીઓ,
અગાઉ અવસાન પામેલ પુત્રના બાળકો.

૧.

૨.

૩.

નિયુક્તિ કરેલ ન હોઈ ઉપર જણાવ્યા પ્રમાણે વ્યક્તિઓને સરખે હિસ્સે મૃત્યુ સહ નિવૃત્તિ
ગ્રેજ્યુર્ટી ચુકવવાની રહે છે. તેમની દરેકની અરજી, ફોટોગ્રાફ્સ, સહીના નમૂના અંગત ઓળખ
વગેરે આ સાથે સામેલ છે.

અથવા

ઉપર જણાવેલ એ અથવા બી પૈકી

શ્રી..... ની તરફે હિસ્સામાં ચુકવણી કરવા માટે
નીચેના વ્યક્તિઓએ સંમતી આપેલ છે :-

૧.

૨.

૩.

અને તે કચેરીના વડાની રૂએ સ્વકારેલ છે. (સંમતિપત્રો સામેલ છે.)

૧૪. કોલમ-૧૩ પૈકી શ્રી સગીર હોઈ તેમની રકમ
કાપદેસરના વાલી શ્રી..... ને ચુકવી આપવાની છે.

(સગીર પુત્ર/પુત્રીનો હિસ્સો, ફુદરતી વાલી એટલે કે માતા/પિતાને ચુકવવાનો છે. અન્ય ડિસ્સામાં
હોય તો વાલીપણાનો દાખલો તેની ઓળખ તથા સરનામાને લગતી આવશ્યક બાબતો સામેલ
રાખવી)

૧૫. આ સાથે નીચેના બિડાણો સામેલ કરું છું.

(૧) પેન્શનરના ગ્રાના કાગળ પર ચોટાડેલ પ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.

(૨) ગ્રાના સહીના નમૂના રાજ્ય પત્રિત અધિકારી ધ્વારા પ્રમાણિત કરેલ. (૩) ઉચ્ચાઈ ઓળખની
બે પ્રમાણીત કાપલી. (૪) અવસાનના દાખલાની પ્રમાણિત નકલ. (૫) ગ્રેજ્યુર્ટી માટે
ભરેલ નિયુક્તિની પ્રમાણિત અથવા મૂળ નકલ. (૬) અન્ય.

સ્થળ :

કચેરીના વડાની સહી

તારીખ :

નામ

હોદ્દો

પેન્શન પેપર્સ

(ભાગ-૫)

નિવૃત્તા થતા બિનસરકારી કર્મચારીઓ માટે ભરવાનું ફોર્મ

રવાના :

ક્રમાંક :

તારીખ:

પ્રતિ,

નિયામકશી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ,

વિમા અને લેખા ભવન,

ડૉ. જીવરાજ મહેતા ભવન શંકુલ

સેકટર-૧૦/બી, ગાંધીનગર

વિષય : બિનસરકારી કર્મચારીઓના પેન્શન પેપર્સ મોકલવા બાબત.

શ્રી/ શ્રીમતી

હોદ્દો :

શાળા :

માનનીયશ્રી,

જ્યબારત સહ ઉપરોક્ત બાબતે આ સાથે શ્રી.....

શાળાના હોદ્દો શ્રી ના પેન્શન પેપર્સ તથા
અસલ સેવાપોથી તૈયાર કરીને નીચેની વિગતે રજૂ કરવામાં આવ છે તો નિવૃત્તિના લાભો અધિકૃત કરવા
વિનંતી છે.

(૧) શ્રી/શ્રીમતી એ તા:

થી તા: સુધીની કરેલ નોકરીની તારીજ નીચે મુજબ છે.

ક્રમ	કઈ કઈ શાળામાં નોકરી કરી તેનું નામ	સમયગાળો તારીખથી તારીખ	કુલ નોકરીના વર્ષ માસ દિવસ	પેન્શનપાત્ર નોકરીના વર્ષ માસ દિવસ
કુલ				

ઉપર જણાવેલ હકીકત કર્મચારીની સેવાપોથીમાંથી પુરતી ચકાસણી કરીને લખેલ છે અને તે સાચી છે.

જિલ્લા શિક્ષણાધિકારી

આચાર્ય

નામ સહી અને સિક્કો

(પેન્શન મંજૂર કરનાર અધિકારીશ્રીનું પુરુ નામ, હોદ્દો, અને કચેરીનો સિક્કો)

- (2) શ્રી/ શ્રીમતી સી.પી.એફ. ની વિગતો
 નીચે મુજબ છે.
- ૧ સી.પી.એફ. યોજનામાં જોડાયા તારીખ
 - ૨ સી.પી.એફ. ખાતા નંબર
 - ૩ કર્મચારીનો વ્યક્તિગત ફાળો વ્યાજ સહિત
 - ૪ સંસ્થા ફાળો (વ્યાજ સહિત)
 - ૫ સરકારી ફાળો (વ્યાજ સહિત જો ચૂકવ્યો હોય તો)
 - ૬ કુલ : (કોલમ-૪+૫+૧)
 - ૭ આ પત્રકમાં જે તારીખ સુધીનું બેલેન્સ પોસ્ટની પાસબુક પ્રમાણોનું લીધું હોય તે તારીખ
 - ૮ કર્મચારીના હિસાબમાં ઉપરોક્ત અનુક્રમ નંબ-૭ પ્રમાણોની કુલ સિલક
 - ૯ ઉપરોક્ત અનુક્રમ નંબર પૈકી કર્મચારીને પોતાની વ્યક્તિગત ફાળો, ડિપોઝિટ, સેવીંગ સર્ટિફિકેટ વગેરેની પોતાના અંગત રોકાણની રકમ
 - ૧૦ ઉપરોક્ત કુલ રકમ અનુ. નંબર્ ૮ પૈકી કર્મચારીએ પેન્શન યોજના સ્વીકારી હોવાથી
 સી.પી.એફ.નો વ્યાજ સહિતનો સદર જે ફાળો સરકારમાં સદરે જમા રકમ
 કરાવ્યાનો થતો હોય તે રકમ

નોંધ :

સી.પી.એફ.નો સંસ્થાનો વ્યાજ સહિતનો સંઘળો ફાળો સરકારી તિજોરીમાં સદરે તે ફાળો તિજોરીમાં જે તારીખે જમા કરાવ્યો હોય તે તારીખ સુધીના વ્યાજનો સમાવેશ થયેલ નહીં હોય તેથી ઉપરોક્ત અ.નં.૭ પ્રમાણો સી.પી.એફ.નો ફાળો જે તારીખના બેલેન્સ સાથે ગણતરીમાં લીધો હોય તે તારીખનો તે વર્ષના માર્ગ સુધીના સમયનું જે તે તારીખે જમા કરાવ્યો હોય તે તારીખ સુધીના વ્યાજના જમા કરાવેલ રકમમાં સમાવેશ થયો નહીં હોય માટે તેટલા સમયનું પોસ્ટના ધોરણો વ્યાજ કરવાનું/ જમા કરાવવાનું થશે તેથી તે વ્યાજની ગણતરી કરીને પેન્શન/ ગ્રેજ્યુરીમાંથી જે જે રકમની વસુલાત કરવાની થાય તેનું પત્રક બનાવીને પેન્શન પેપર્સ સાથે સામેલ કરીને વસુલાતની રકમ જણાવતી અથવા તે રકમ..... સદરે જમા કરાવીને અસલ પેન્શન પેપર્સ સાથે સામેલ કરવું.

- (3) સી.પી.એફ. સંબંધીત પ્રમાણપત્રો (માધ્યમીક શાળાઓના કર્મચારીએ માટે)
૧. આથી પ્રમાણપત્ર આપવામાં આવ છે કે, સદરહુ કર્મચારીને સી.પી.એફ. ખાતું ચકાસ્યું છે અને તે બાબત માલુમ પડે છે.
 ૨. આથી પ્રમાણપત્ર આપવામાં આવ છે કે, સી.પી.એફ.નો સંસ્થાનો સહિતનો રૂ. નો ફાળો ટ્રેજરીમાં ચલણ નં. તારીખ: થી બજેટ હેડ જમા કરાવ્યો છે અને હવે સંસ્થા/સરકારી ફાળાની મુદત તથા વ્યાજ પેટેની કોઈ રકમ જમા કરાવવાની બાકી નથી.
 ૩. શ્રી/શ્રીમતી તા: થી તા: સુધી સી.પી.એફ. યોજનામાં જોડાયેલા ન હતા તેથી તે સમયની નોકરી માટે કોઈપણ પ્રકારનો ફાળો જમા કરાવવાનો બાકી નથી.

કચેરીનું સીલ

આચાર્ય
નામ સહી અને સિક્કો

જિલ્લાશિક્ષણાધિકારી
(પેન્શન મંજૂર કરનાર)

૪. જમા કરાવેલ સી.પી.એફ. ના ફાળની રકમમાં તા: સુધીના સમયના
વ્યાજનો સમાવેશ થયેલ હતો. તેથી હવે તા: થી તા:
સુધીના સયમનું વ્યાજ રા. ડી.સી.આરજી.માંથી કાપી લેવાનું છે અને
હેડ અથવા આ સાથેના ચલન પ્રમાણે જમા કરાવેલ છે.
૫. આથી પ્રમાણપત્ર આપવામાં આવ છે કે, શ્રી/ શ્રીમતી
તા:થી તા: સુધીની તેમની સમગ્ર નોકરી દરમ્યાન
ક્યારેય સી.પી.એફ. યોજનામાં જોડાયેલ ન હતા. પરંતુ તેઓ તે સમય દરમ્યાન સી.પી.એફ.
યોજનામાં જોડાવાની પાગતા ધરાવતા હતા.

આચાર્ય
નામ સહી અને સિક્કો

જિલ્લાશિક્ષણાધિકારી
(પેન્શન મંજૂર કરનાર)

(કોલેજ/ યુનિવર્સિટીઓના કર્મચારીઓ માટે)

- (૪) શ્રી/શ્રીમતી
સી.પી.એફ.ની વિગતો નીચે પ્રમાણે છે.
સી.પી.એફ. એકાઉન્ટ નંબર:
કમ નોકરી કરેલ કોલેજનું નામ નોકરીનો સમયતારીખ થી તારીખ સુધી આ
સમયની નોકરી દરમ્યાન સી.પી.એફ.માં જોડાયાનો સમય તારીખ થી તારીખ સુધી

કુલ :

-
-
-

(૫) સી.પી.એફ. સંબંધીત પ્રમાણપત્ર : (કોલેજ/ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે)

- ૧) શ્રી/શ્રીમતી..... તેમની તા: થી
તા: સુધીની નોકરી માટે સી.પી.એફ. યોજનામાં જોડાયેલ હતા અને તે તારીખ
સુધીનો મેનેજમેન્ટનો વ્યાજ સહિતનો ફાળો રા. તેમજ ગ્રેજ્યુટી ની રકમ
રા. તા: ના રોજ સરકારી તિશેરીમાં સદરે
જમા કરાવ્યો છે અને હવે આવી કોઈ રકમ જમા કરાવાની બાકી રહેતી નથી.

ઉચ્ચ શિક્ષણ કમિશનરીની સહી

આચાર્ય

(પેન્શન મંજૂર કરનાર અધિકારીશ્રીનું પુરુ નામ અને કચેરીનો સિક્કો) નામ અને સહી સિક્કો

પ્રમાણપત્રો (માધ્યમીક શાળા/ કોલેજ/ યુનિવર્સિટીના કર્મચારીઓ સબંધીત)

(લાગુ પડતા પ્રમાણપત્રો ટૂંકી કરી છેકી નાખવા)

શ્રી હોદ્ડો તા:ના

રોજ વય/ સ્વૈચ્છિક નિવૃત્તિથાય છે/ મૃત્યુ પામેલ છે. તેઓની સેવાપોથીની ચકાસણી કરીને નીચે મુજબ
પ્રમાણપત્રો આપવામાં આવે છે.

- ૧) મજકુર કર્મચારીએ તા: થી તા: સુધીની જે જે
નોકરી કરી છે તે બિનસરકારી માન્ય અને અનુદાન મેળવતી સેકન્ડરી શાળાઓની છે.
- ૨) મજકુર કર્મચારી તા: થી તા: સધી સરકારી
અનુદાનમાંથી પગાર અને ભથ્થાની ચકુવણી કરવામાં આવી છે.
- ૩) મજકુર કર્મચારી તા: તા: સુધી તેમની
નોકરીના દરેક વર્ષ માટે ગ્રાન્ટ-ઇન-એઈડ, સેકન્ડરી એજયુકેશન રેઝલ્યુલેશનના નિયમાનુસાર
નિયત રેશીયા પ્રમાણોના કર્મચારી હતા તેમજ કોઈપણ વર્ષ વધારાના અવેજી, પાર્ટ ટાઈમ
કર્મચારી હતા નહીં.
- ૪) મજકુર કર્મચારીએ તા: થી તા: સુધીની પોતાની
સમગ્ર નોકરી દરમ્યાન તાલીમના શાળા સહિત છગ્ગીસ માસથી વધારે વિનપગાર (અસાધારણ)
રજાઓ ભોગવેલ નથી.
- ૫) મજકુર કર્મચારીને ૨૦% ની મર્યાદામાં સિલેક્શન ગ્રેડના પગારધોરણમાં પગાર નક્કી કરી
આપો છે, જે બરાબર છે અને તે અંગેની કોઈ વસુલાત કરવાની થતી નથી.
- ૬) મજકુર કર્મચારીને ભૂતપુર્વ શિક્ષણ અને મજકુર વિભાગના તા: ૪/૬/૯૫ ના દરાવ નં.
આઈઓનઓસ/ ૧૯૦૧/ગ મુજબ રાખિણ શિક્ષક તરીકે જાહેર કરેલ છે. તેથી તેમની તા :
..... થી તા: સુધીની નોકરી પેન્શનપાત્ર ગણવાની છે.
(હુકમની નકલ સામેલ રાખવી)
- ૭) મજકુર કર્મચારીએ તા: થી તા: સુધી
..... નામની મિડલ સ્કૂલમાં નોકરી કરી હતી તે સમગ્ર મિડલ સ્કૂલ
..... નામની માન્ય અને અનુદાન મેળવતી બિનસરકારી માધ્યમકી
શાળા સાથે જોડાયેલી હતી.
- ૮) મજકુર કર્મચારીએ તા: થી તા: સુધીની
પોતાની સમગ્ર નોકરી દરમ્યાન જે પગાર ચૂકવ્યો તે સરકારશીએ માન્ય કરેલ પગારધોરણમાં
ચૂકવ્યો છે. તેમજ મજકુરને વખતો વખત લાગુ પડાયેલ તમામ પગારધોરણ માન્ય રાખવામાં
આવેલ છે. વધુમાં આ તમામ પ્રકારના પગાર ધોરણનું ફીક્સેશન કરાવી તેની નોંધો મજકુરની
સેવાપોથીમાં કરાવવામાં આવેલી છે અને કોઈ પગારધોરણમાં ફીક્સેશન દરાવવું બાકી નથી.
- ૯) મજકુર કર્મચારીની તા: થી નિવૃત્તિની તા:
સુધીની સેવાપોથી તથા લીલ એકાઉન્ટની તમામ નોંધો વર્ષવાર સંપૂર્ણ લખવામાં આવેલી છે
અને તેમાં હવે વધુ કોઈ નોંધ કરવી બાકી નથી તેમજ તમામ નોંધો શાળાના રેકર્ડ સાથે સરખાવી
ચકાસેલ છે અને બરાબર માલુમ પડેલ છે.
- (૧) પેન્શન યોજના સ્વીકાર્યાનું અસલ ઓપ્શન ફોર્મ. (૨) સી.પી.એફ. જમા કરાવ્યાનું અસલ ચલન.
(૩) અવાસનના કેસમાં અવસાનનું પ્રમાણપત્ર. (૪) અશક્તિતના પેન્શન કેસમાં દાકતરી પ્રમાણપત્ર.
(૫) બ્રેક કન્ડોનના હુકમોની પ્રમાણીત નકલો.

કર્મચારીની સહી- આચાર્ય ની સહી/સંચાલકની સહી - જિલ્લા શિક્ષણાધિકારી/ઉચ્ચ શિક્ષણ કમિશનરી સહી

નામ અને સહી સિક્કો (પેન્શન મંજૂર કરનાર અધિકારીશીનું પુરુ નામ અને કચેરીનો સિક્કો)

સરકારી મધ્યરથ મુદ્દાલય, ગાંધીનગર.